

ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, અમદાવાદ

તા. 23-12-2015

પ્રેસ નોંધ

રાજ્યમાં ઈજનેરી વિદ્યાશાખાનાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની આઈ.આઈ.ટી. કક્ષાની સંસ્થાઓ મુજબનાં અભ્યાસક્રમો અને સંશોધનની સગવડતાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા માહે જૂન 2013થી અત્રેની સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ છે. સંસ્થા ખાતે હાલમાં સ્નાતક કક્ષાનાં સિવિલ, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ ઈજનેરી વિદ્યાશાખાના અભ્યાસક્રમો ચાલી રહેલ છે. ટૂંક સમયમાં અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાનાં અભ્યાસક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે.

સંસ્થા ખાતે અભ્યાસરત વિદ્યાર્થીઓ તેઓની શૈક્ષણિક ઉપરાંત Extra-curricular ક્ષમતાઓ પણ વિકસિત કરી શકે અને તેને પ્રદર્શિત કરી શકે તે માટે સંસ્થા દ્વારા પ્રથમવાર વાર્ષિક ટેકનો-કલ્ચર ફેસ્ટીવલ “Repertus 2K16”નું આગામી તા. 5 થી 7, ફેબ્રુઆરી, 2016નાં રોજ સંસ્થા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેની મુખ્ય થીમ “Smart Infrastructure” છે. આ ફેસ્ટીવલમાં સમગ્ર દેશમાંથી અગ્રણી સંસ્થાઓનાં વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.

“એક વ્યક્તિ ફેરફાર લાવી શકે છે અને દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ” તેને અનુસરીને સંસ્થા દ્વારા “Repertus 2K16”નાં ભાગરૂપે વિદ્યાર્થીઓ સફાઈની મહત્તા સમજી શકે અને તેને આનુષંગિક સંદેશો સમાજમાં વહેતો કરી શકે તે માટે તા. 20-12-2015ને રવિવારનાં રોજ સવારે મણિનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં સંસ્થાનાં તમામ વર્ગોનાં વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા ખાતે કાર્યરત શૈક્ષણિક અધિકારીઓ અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલ હતો. ભાગ લેનાર તમામ દ્વારા સદર બસ સ્ટેન્ડ ખાતે કચરાનાં સફાઈની કામગીરી કરવામાં આવેલ હતી. જેને તત્કાલીન સમયે હાજર નગરજનો દ્વારા પણ બિરદાવવામાં આવેલ હતી. વધુમાં સ્વચ્છતા બાબતે સમાજમાં જાગૃતિ આવી શકે તે માટે વિવિધ આનુષંગિક સ્લોગન પણ પ્રદર્શિત કરીને રેલી કાઢવામાં આવેલ હતી.

સદર કાર્યક્રમનાં ફોટોગ્રાફ આ સાથે સામેલ છે.



